



EXPRESSWAY RETREAT



Adhelai The Eastern Gateway To Dholera SIR



Prime Proximity

Strategically off India's first **IGBC Platinum-rated** greenfield smart city, Dholera.



Express Access

Instant SIR connectivity from NH751, **Ahmedabad-Dholera Expressway**



Coastal Rail Framework

Vital segment of the proposed **924-km corridor** linking Khambhat, Dholera, and Bhavnagar.



Sea-Link edge

Upcoming Dahej-Bhavnagar **rail sea-link** quick links Adhelai to Dahej



Port Fast-Track

Coastal corridor unlocks quick access to Bhavnagar Port, elevating Adhelai's **investment edge**.



Logistics Multiplier

Tri-modal supremacy with coastal, rail, sea-link serves as freight interchange for **DSIR's** semiconductors/electronics clusters.



Exports Lens

Links to **Amritsar-Jamnagar** Economic Corridor facilitating northern exports through Jamnagar, Kandla.

A Milestone Address

**Bang On
SIR Recreation
Zone**

**0 Point Km From
SIR Boundary**

**Adjacent To
Reliance
Commercial Land**

**2 Kms From
Ahmedabad Dholera
Expressway**

**4 Mins From
Adhelai Diamond Circle**

**15 Mins From
Velavadar Blackbuck
Sanctuary**

**5.5 Acres
Planned Township
With In-built
Amenties**



Project Amenities

Herb / Aroma Garden

Quiet Reading &
Relaxation Nook

Water Rill
Fountain Feature

Lotus Pond
Reflecting Water
Body

Kids' Play Area

Senior Citizen
Seating Zone

Senior Citizen
Seating Zone

Mini Amphitheatre
Stepped Lawn

Security Cabin

Entry Gate

CCTV Monitoring

24 Hrs. Water



Swimming Pool

Kids' Splash Pad

Gymnasium
Fitness Studio

Yoga & Dance
Pavilion

Wellness &
Meditation Zone

Spa + Sauna +
Steam Room

Outdoor Jacuzzi
Hot Tub

Badminton Court
(Convertible)

Tennis / Pickleball
Court

Basketball Half Court

Foot Reflexology Path

Zen Garden

Land Location



Layout



Inventory

PLOT NO.	CARPET Area SQ.YAR	SUP.BUILTUP Area SQ.YAR	PLOT NO.	CARPET Area SQ.YAR	SUP.BUILTUP Area SQ.YAR	PLOT NO.	CARPET Area SQ.YAR	SUP.BUILTUP Area SQ.YAR	PLOT NO.	CARPET Area SQ.YAR	SUP.BUILTUP Area SQ.YAR	PLOT NO.	CARPET Area SQ.YAR	SUP.BUILTUP Area SQ.YAR
1	147.05	261.06	31	89.01	158.02	61	89.01	158.02	91	89.01	158.02	121	94.84	168.38
2	152.37	270.51	32	89.01	158.02	62	89.01	158.02	92	89.01	158.02	122	107.49	190.83
3	151.18	268.40	33	89.01	158.02	63	89.01	158.02	93	89.01	158.02	123	116.73	207.23
4	149.99	266.29	34	89.01	158.02	64	89.01	158.02	94	89.01	158.02	124	107.49	190.83
5	148.80	264.17	35	89.01	158.02	65	65.79	116.80	95	107.49	190.83	125	94.84	168.38
6	147.61	262.06	36	89.01	158.03	66	65.78	116.78	96	116.73	207.23	126	94.84	168.38
7	146.42	259.95	37	89.02	158.05	67	65.78	116.78	97	107.49	190.83	127	116.92	207.57
8	145.23	257.83	38	89.01	158.02	68	111.94	198.72	98	89.01	158.02	128	112.54	199.79
9	88.99	157.99	39	94.84	168.38	69	111.94	198.72	99	89.01	158.02	129	89.01	158.02
10	89.01	158.02	40	94.84	168.38	70	65.78	116.78	100	89.01	158.02	130	89.01	158.02
11	94.84	168.38	41	107.51	190.87	71	65.78	116.78	101	89.01	158.02	131	89.01	158.02
12	94.84	168.38	42	116.75	207.26	72	65.79	116.80	102	89.01	158.02	132	89.01	158.02
13	107.51	190.86	43	107.51	190.86	73	84.55	150.10	103	131.09	232.74	133	89.01	158.02
14	116.75	207.26	44	94.84	168.38	74	65.78	116.78	104	126.72	224.96	134	107.49	190.83
15	107.51	190.86	45	94.84	168.38	75	65.78	116.78	105	89.01	158.02	135	116.73	207.23
16	94.84	168.38	46	89.01	158.02	76	65.78	116.78	106	89.01	158.02	136	107.49	190.83
17	94.84	168.38	47	89.02	158.05	77	65.78	116.78	107	89.01	158.02	137	89.01	158.02
18	89.01	158.01	48	89.02	158.03	78	94.95	168.57	108	89.01	158.02	138	89.01	158.02
19	89.00	158.00	49	89.01	158.02	79	99.99	177.52	109	89.01	158.02	139	89.01	158.02
20	89.01	158.02	50	89.01	158.02	80	71.74	127.37	110	107.49	190.83	140	89.01	158.02
21	89.01	158.02	51	89.01	158.02	81	71.74	127.37	111	116.73	207.23	141	89.01	158.02
22	89.01	158.02	52	89.01	158.02	82	127.95	227.16	112	107.49	190.83	142	109.83	194.98
23	89.01	158.02	53	89.01	158.02	83	87.74	155.77	113	89.01	158.02	143	143.82	255.32
24	89.01	158.02	54	89.01	158.02	84	65.78	116.78	114	89.01	158.02	144	146.68	260.41
25	89.01	158.02	55	107.51	190.86	85	81.10	143.97	115	89.01	158.02	145	145.72	258.71
26	89.01	158.02	56	116.75	207.26	86	85.14	151.15	116	89.01	158.02	146	144.77	257.01
27	107.51	190.87	57	107.51	190.86	87	65.78	116.78	117	89.01	158.02	147	143.81	255.31
28	116.75	207.26	58	89.01	158.02	88	73.10	129.78	118	124.01	220.15	148	142.86	253.62
29	107.51	190.86	59	89.01	158.02	89	133.81	237.55	119	119.63	212.38	149	141.90	251.92
30	89.01	158.02	60	89.01	158.02	90	89.01	158.02	120	94.84	168.38	150	151.08	268.22

Area Table		
PLOT NO.	DETAIL	CARPET Area SQ.MT
1	1 TO 100 PLOT AREA	13442.78
2	ROAD AREA	8846.13
3	COMMON PLOT AREA	2237.24
4	SET-BACK AREA	484.32
TOTAL		22890.00



Enjoy Your Lifestyle Of Choice





Curated Amenities

Embrace an 'away from clutter' lifestyle that's 'full of life.'

Retreat Living

Revel in low-density settings away from urban intensity blended with regional access.





Natural Glory

Explore the underbelly of nearby water systems amid natural landscaping.

Clubhouse Living

Own it, live it, experience it!





EXPRESSWAY RETREAT

Total Area - 26,536 Sq. Yard

Total Area - 2,38,824 Sq. Ft.

On Dholera to Bhavnagar Expressway Road

Near By - Dholera 250 Mtr. Wide Express Way

& Dholera SIR Boundary



EXPRESSWAY RETREAT

~~₹ 10,999/-~~ **₹ 8,999*/-** Sq. yard

Plot Configuration

Smart Plots
100-150 sq. yd

Signature Plots
150 – 250 sq. yd

Grande Plots
250 Onwards

Base Pricing (All categories)

Pre-Launch BSP*
₹ 8,999 / sq. yd

Launch BSP
₹ 10,999 / sq. yd

**Preferential Location
Charges (PLC)**

5%-10% as applicable

**Payment Plan
(Plot Cost)**

Token/EOI : ₹1 lakh | 50% within 15 days
Remaining 50% within 30 days

Development Charges

Now

1 year before possession

₹1,000 / sq. yd

₹1,000 / sq. yd

Other Charges

GST and Registry as applicable

**Timely Payment Discount
(Only Active Offer)**

Within 15 Days: – ₹500 / sq. yd

Timely Payment: – ₹250 / sq. yd

EXPRESSWAY RETREAT				
UNIT NO:-	66		STATUS	AVAILABLE
PAYMENT PLAN			10:40:50	
SIZE:-	116.78	SQ YARD	₹ 1,050,903	
BASIC PRICE	₹ 10,999			
INAUGRAL DISCOUNT	₹ 2,000			
NET BSP	₹ 8,999	RS./ SQ. YARD		
PLC CORNER 7.5%			0.0%	₹ -
12 METER ROAD 7.5%			0.0%	₹ -
PLC MAIN ROAD 10%			0.0%	₹ -
PLC PARK 5%			0.0%	₹ -
TOTAL (BASIC + PLC)				₹ 1,050,903
TIMELY PAYMENT REBATE (APPLICABLE ONLY WHEN 100% PAYMENT RECEIVED WITHIN 30 DAYS OF BOOKING)			₹ 250	₹ 29,195
NET BSP (I)				₹ 1,021,708
DEVELOPMENT CHARGES ONE TIME				
EDC			₹ 250	₹ 29,195
IDC			₹ 250	₹ 29,195
ELECTRIFICATION CHARGES			₹ 250	₹ 29,195
MAINTENANCE INFRASTRUCTURE CHARGES			₹ 250	₹ 29,195
CLUB MEMBERSHIP			₹ 1,000	₹ 116,780
TOTAL COST WITH GST (I+II)				₹ 233,560

IndusInd Bank

DHAROHAR LAND CORPORATION PVT LTD
SCAN & PAY



UPI ID: pos.5351721@indus



Bank Details

Company Name	DHAROHAR LAND CORPORATION PRIVATE LIMITED
Bank Name	INDUSIND BANK
Branch	SECTOR-18, NOIDA
IFSC Code	INDB00000036
Account No.	253003042020

N.A. Order {192P1}

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, ભાવનગર

કલેક્ટર કચેરી, મોતીબાગ રોડ, ભાવનગર - 358001 (ગુજરાત)

ફોન નંબર : 0283-242222

ઇમેઇલ : collector-bev@gujarat.gov.in

ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1920 ની કલમ-54 હેઠળ [નિત્યેતી - રહેણાંક]

ફાઇલ નં. 77714050032025

ત. 09/10/2025

વંચાણે લીધા :-

(1) અરજદારશ્રી જનકા વિશ્વમ પુરામ

રો. મુ. ભાવનગર, 10/7/21 રેલી નં. 1 કાર્ડિનલર, વિ.ક. ભાવનગર-364004 ની ત.13/08/2025 ની બેનવાઇન અરજ (નં.3140502501369) તથા સેન્ટેન્સ

(2) મુલત જમીન મહેસૂલ કલેક્ટર 1000 ની કલમ - 54, 55, 56 તથા 57

(3) ગુજરાત જમીન મહેસૂલ નિયમો, 1920 ના નિયમ 19, 100, 101, 102

(4) સરકારીના મહેસૂલ વિભાગના કલમ નં. 4004/1005/824/3 ત.01/03/2000

(5) સરકારીના મહેસૂલ વિભાગના પરીપત્ર ક્રમાંક 4004/1005/824/3 ત.01/04/2010

(6) સરકારીના મહેસૂલ વિભાગના કલમ ક્રમાંક 4004/1005/824/3 ત.01/03/2011

(7) સરકારીના મહેસૂલ વિભાગના કલમ ક્રમાંક 4004/1005/824/3 ત.01/03/2010

(8) સરકારીના મહેસૂલ વિભાગના પરીપત્ર ક્રમાંક 4004/1005/824/3 ત.01/03/2010

(9) ન્યાય કલેક્ટર શ્રી (એમ. ડુર્ગ) ને ત.28/08/2025 ને અધિવાસ

મામલદાર અને કૃષિપંચ શ્રી (A.T.) ને ત.01/09/2025 ને અધિવાસ

શ્રી અર્જ મેલ અર. શ્રી ને ત.28/08/2025 ને અધિવાસ

(10) NCMIS પોર્ટલ પરની ફેલ વિગત

ફેલ :-

વંચાણે લીધેલ ફેલ (1) ની અરજ તથા સેન્ટેન્સ શ્રી અરજદારશ્રી જનકા વિશ્વમ પુરામ ને એજેન્ડા ત. ભાવનગર જિ. ભાવનગર નં. 192P1 ના હેડર 22,188.00 ચો.મી. ની જમીન અને ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1920 ની કલમ-54 હેઠળ નિત્યેતીના ડેનું માટે પરાવાનગી આપવા વિનવેલી ફેલ છે.

2. ભાવનગરની જમીનના ન્યાય નમુના નં. 3/12 માં કલેક્ટરની વિગત નીચે મુજબ છે.

સરવેખોલક નંબર	માંગણીનું હેડર (ચો.મી.)	કલેક્ટરની નામ (આ. નં. 523)	જમીનનો માલિક (જમીન મુજબ)
સરવે/ખોલક નં. : 192P1	22,188.00	જનકા વિશ્વમ પુરામ	જુની કાન (જુ.કા)



0142025100030057



Validity unknown
Signed by : A D Khatav
Date : 2025.10.09 11:22:30 IST

Open the document in Adobe Acrobat Reader to verify the e-Sign.

Courtesy: NRC, Gujarat

Application No.2140502501369

Order No.77714050032025

Page 1 of 5

3. વસુલ કરવામાં આવેલ કરવેલની વિગત નીચે મુજબ છે.

બેકમાં માલિક તા.07/10/2025 નં.5700001355003507102587865

કલની વિગત	સર	માંગણીનું હેડર (ચો.મી.)	દર રૂ. પત્ર ચો.મી.	કુલ રકમ રૂ.
રૂપાતર કર	549-0035-00-800-01	22,188.00	2.00	44,376.00
વિશાંક પાત્ર	570-0035-00-101-01	22,188.00	0.10	2,219.00
લેન્ડલ \$5	574-0029-00-103-01	22,188.00	0.05	1,109.00
લેન્ડલ રૂપાતર	575-0045-00-108-01	22,188.00	0.05	1,109.00
માપણી ફી	577-0029-00-106-01	22,188.00	---	3,600.00
સેમ્પલ ડુપ્લિકેટી આફી	1473-0030-02-800-01	22,188.00	---	14,119.00
વસુલ				
				86,532.00

4. ઉપરોક્ત તમામ હકીકતે પદને 009 ચોજી અધિકાર ત. ભાવનગર જિ. ભાવનગર નં. 192P1 ના હેડર 22,188.00 ચો.મી. ની જમીનને નીચે જણાવેલ કારણોને અધીન ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1920 ની કલમ-54 હેઠળ નિત્યેતી ડેનું (રહેણાંક) માટે પરાવાનગી આપવા આજી રૂકમ કરવામાં આવે છે.

કારણો :-

(1) આ રૂકમ મળેલી એ મહત્તમ "એમ" નમુનામાં સ્પષ્ટ પાત્ર થશે.

(2) જિલ્લા હન્ટરશ્રી, જમીન રેકૉર્ડની કચેરીમાં માપણી ફી જમા કરાવેલ છે. જેથી માપણી ફી/ કરાવી આ રૂકમ આપે તેમજ મજૂર થયેલ પાત્ર મુજબ દુરભવી પત્રક તૈયાર કરાવવાનું રહેશે અને દુરભવી પત્રકને મહેસૂલી દફતરે અમલ થાય બદ જ પત્રકવાળી નિત્યેતીની જમીન/ પ્લોટનું રજા દાખલેથી થયેલ વેચાણ વ્યવસ્થા અમલ માટે નોંધ પડવાની રહેશે.

(3) અરજદાર પત્ર ચર્ચે પેટી સિવાયના કારણો (વિશેષપાત્ર) 3 દર પત્ર ચો.મી. ના રૂ. 0.10 પાત્ર રૂ. 2,219.00 તેમજ નિયમ પાત્ર લેન્ડલ \$5 તથા લેન્ડલ રૂપાતર પાત્ર જે અંગેની દર વખતેનામત ફેરફારને પાત્ર રહેશે.

(4) ભાવનગર નગર નિયોજક કચેરી એ મજૂર કરેલ પાત્ર મુજબ આંકડા કરાવવાનું રહેશે.

(5) સરકારીના મહેસૂલ વિભાગના કલમ નં.4004/1005/824/3 ત.01/03/2010 માં કલમ મુજબ સરકાર/ કોમન પ્લોટ અને રાજ્યની જમીન સોંપાણીની મલિકીની અભાવ સર્વે પ્લોટ ડેવલપની સરકારી મલિકીની ગણાશે તે ઉપરાંત મુલ મલિકીને ફેલ 388 રહેશે નહીં.

(6) સરકારીના મહેસૂલ વિભાગના ત.03/04/1961 ના પરીપત્ર નં.4004/1005/824/3 ની જોગવાઈ મુજબ મિન અધિકૃત આંકડા અમલે આંકડા નિયમ કરતી સંબંધિત માન્યરખાલિકા/ કહેલી વિશ્વર કામ મંડળને હોદ્દાકારના પાત્ર લેવાની રહેશે.

(7) સરકારીના મહેસૂલ વિભાગના પાણીની કે અન્ય કોઈપણ પત્રકની પાત્રપાત્રના પત્રક થતી રહે તે તે સર્વે વિશ્વર પરાવાનગી આપવા પોલોટીટીમે સમયોત્તેજ ના-વાંચ પમાણપત્ર મેકવી વિશ્વર પરાવાનગી આપવાની રહેશે.

(8) સરકારીના મહેસૂલ વિભાગના ત.12/01/2016 ના પરીપત્ર નં.4004/1005/824/3 મુજબની નીચેની કારણો પાત્ર કરાવવાનું રહેશે.

1. જો અગાઉ વેચાણ ડેનું માટે વિધિયમ કારણ થયેલ રહે અને અન્ય ડેનું માટે વિશ્વર પરાવાનગી મળેલ રહે/ નહા મજૂર કરવાના કાલ રેમ તે વિશ્વર પરાવાનગી આપતાં પહેલાં વિધિયમ તકાવાત સત્તાવાની સંબંધિત સત્તાવાને અગતી કરવાની રહેશે અને ત્યાંબદ જ વિશ્વર પરાવાનગી આપવાની રહેશે.
2. જાડીશીબદ મુજબ જે તે ડેનું ઉપયોગ માટે પરાવાનગી મારવાપાત્ર નહીં રેમ તે તે ઉપયોગ કરી થાશે નહીં.
3. પેટી ઝોનમાં જાડીશીબદ મુજબ જેટલું આંકડા મારવાપાત્ર રહે તેટલું જ હેડર માટે વિશ્વર પરાવાનગી આપવાની રહેશે.
4. નિત્યેતી પરાવાનગી માલિક આર જો માલ મજૂરી સિવા ધાર્મિક ઉપયોગ માટે આંકડા કરેલ રહે તે તે સતતસ ગણાશે અને તે આંકડા દૂર કરવાપાત્ર થશે.

(9) સરકારીના મહેસૂલ વિભાગના ત.01/03/2000 ના કલમ નં.4004/1005/824/3 માં જણાવેલ નીચે મુજબની કારણો પાત્ર કરાવવાનું રહેશે.



0142025100030057



Validity unknown
Signed by : A D Khatav
Date : 2025.10.09 11:22:30 IST

Open the document in Adobe Acrobat Reader to verify the e-Sign.

Courtesy: NRC, Gujarat

Application No.2140502501369

Order No.77714050032025

Page 2 of 5

Reliance Land Registry

સબ રજીસ્ટ્રાર		S.R.O - Bhavnagar-4 RURAL(Tarasmiya)		ઓફિસમાં નોંધાયેલ દસ્તાવેજની વિગત			
દસ્તાવેજ કરી આપનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના હુકમનામા અથવા આદેશના સંબંધમાં પ્રતિવાદીનું નામ	દસ્તાવેજ કરી લેનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના હુકમનામા અથવા આદેશના સંબંધમાં વાદીનું નામ	સર્વે નંબર પેટા વિભાગ નંબર અને ધર નંબર (જો કંઈ પણ હોય તો)	આકાર અથવા જુડી આપવામાં આવે ત્યારે તે	દસ્તાવેજનો પ્રકાર અને અવેજ (ભાડા પટાના કિસ્સામાં આકાર પટે આપનાર અથવા પટે રાખનાર આપે છે તે પ્રકારનો)	નોંધણીની તારીખ સડીની તારીખ	અનુક્રમ, વોલ્યુમ અને પૃષ્ઠ નંબર	શેરી
મીતાબેન મનોજભાઈ સાવલા પ્રીતિબેન પારસભાઈ સાવલા અવનીબેન ધરેનભાઈ સાવલા રૂપેશભાઈ કાંતિલાલ સાવલા શીતલબેન રૂપેશભાઈ સાવલા	RELIANCE PROGRESSIVE TRADERS PRIVATE LIMITED ની અધિકૃત વ્યક્તિ શ્રી પટેલ આનંદ નારણભાઈ	ગામનું નામ :અધેજાઈ પરિશિષ્ટ-૧ - રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ ભાવનગર સબ-ડિસ્ટ્રિક્ટ અને તાલુકા ભાવનગર, મોજે- અધેજાઈ ગામની સીમના સર્વે/બ્લોક નંબર- ૧૯૪ પૈકી ૧ ના ખાતા નંબર:- ૨૮૪ ની હે-આરે-ચોમી ૧-૭૬-૦૪ યાને કે ૧૭૬૦૪ ચોરસમીટર ખેતીની જમીન, પરિશિષ્ટ-૨ - રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ ભાવનગર સબ-ડિસ્ટ્રિક્ટ અને તાલુકા ભાવનગર, મોજે- અધેજાઈ ગામની સીમના સર્વે/બ્લોક નંબર-૧૯૪ પૈકી ૨ ના ખાતા નંબર:- ૨૮૪ ની હે-આરે-ચોમી ૧-૬૧-૮૮ યાને કે ૧૬૧૮૮ ચોરસમીટર ખેતીની જમીન, પરિશિષ્ટ-૩ - રજીસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ ભાવનગર સબ-ડિસ્ટ્રિક્ટ અને તાલુકા ભાવનગર, મોજે- અધેજાઈ ગામની સીમના સર્વે/બ્લોક નંબર-૧૯૪ પૈકી ૩ ના ખાતા નંબર:- ૨૮૪ ની હે-આરે-ચોમી ૧-૬૧-૮૮ યાને કે ૧૬૧૮૮ ચોરસમીટર પૈકી હે-આરે-ચોમી ૧-૨૧-૩૮ યાને કે ૧૨૧૩૮ ચોરસમીટર ખેતીની જમીન,	માલિકી ફેરખત/વેચાણ	શ્રી.4200000000	01/05/2023	2569	
વિગતો ત્યાંપણી જાણુ મારે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં					01/05/2023		
વિગતો ત્યાંપણી જાણુ મારે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં							
વિગતો ત્યાંપણી જાણુ મારે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં							
વિગતો ત્યાંપણી જાણુ મારે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં							
વિગતો ત્યાંપણી જાણુ મારે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં							

Ankit Aditya Pradhan

Founder Chairman & Managing Director

B.Tech, MBA - IMT

The Making of **VIRAAJ VENTURES**

Embracing diversity for a better tomorrow

Viraaj Ventures creates sustainable businesses defined by strategy innovation, technology adoption, and scalability. We value nurturing and investing in concepts that promote sustainable growth and incorporate eco-friendly strategies into viable business models that positively impact the planet.

We thrive on leveraging the interconnectedness of sectors to galvanise people and opportunities in IT enlistment & recruitment, wealth management & BFSI, legal & corporate advisory, real estate & infrastructure development, and structural & civil engineering consulting.

Viraaj Ventures

Group of Companies





EXPRESSWAY RETREAT

EXPRESSWAY RETREAT

📍 Sovereign Corporate Towers, 3rd Floor,
Plot No: A-143, Sector-136, Noida, UP 201304

☎ +91 75 0000 1010

✉ land@dharocharlandcorp.com

🌐 www.dharocharlandcorp.com